




ઘરમાંથી બહાર નીકળવાની યોજના

તમારી યોજનાનો અવારનવાર અભ્યાસ કરો



1

તમારી બહાર નીકળવાની યોજના તમારા કુટુંબીજનોને સાથે રાખીને દોરો. તમારા ઘરની સામે બહાર જ્યાં મળવું તે જાણો.



2

શક્ય હોય તો, દરેક રૂમમાંથી બહાર નીકળવાના બે માર્ગોની યોજના બનાવો.




3

તમારી યોજનાની ચર્ચા તમારા ઘરમાં દરેક વ્યક્તિ સાથે કરો. મદદની જરૂરિયાત ધરાવતા લોકોને ઓળખી કાઢો.



4

ઝડપથી બહાર નીકળો અને બહાર રહો.



5

તમે ઘર છોડો ત્યારે તમારી પાછળના દરવાજા બંધ કરો.



6

તમારે ભેગા થવાની જગ્યાએથી અથવા પડોશીના ઘરેથી 9-1-1 ને કોલ કરો.

brampton.ca | firelife@brampton.ca | 905.458.5580

 BramptonFire  @BramptonFireES

 BRAMPTON

